

કીટકશાસ્ત્રવિભાગ, બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આ.કૃ.યુ., આણંદ તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આ.કૃ.યુ.,
દેવાતજના સંયુક્ત ઉપક્રમે “સંકલિત જીવાત વ્યવસ્થાપન” વિષયપર ચાર દિવસીય તાલીમ
કાર્યક્રમ યોજાયો

કીટકશાસ્ત્ર વિભાગ, બં. અ. કૃષિ મહાવિદ્યાલય, આ.કૃ.યુ., આણંદ તથા કૃષિ વિજ્ઞાનકેન્દ્ર, આ.કૃ.યુ., દેવાતજના સંયુક્ત ઉપક્રમે “સંકલિત જીવાત વ્યવસ્થાપન” વિષયપર તા. ૦૭.૦૬.૨૦૨૨ થી ૧૦.૦૬.૨૦૨૨ દરમિયાન ચાર દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન માન કુલપતિશ્રી, આ.કૃ.યુ., આણંદ ડૉ. કે. બી. કથીરીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ જેમાં આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના ગાડા, પલોલ અને લીંબાલી ગામના કુલ ૪૦ ખેડૂતોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે કેવિકેના વડા ડૉ. એ. સી. વૈદ્યે સંકલિત જીવાત વ્યવસ્થાપન અંગે કેવિકે દ્વારા કરવામાં આવતી વિસ્તરણ શિક્ષણ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપેલ ત્યારબાદ તાલીમના સમયગાળા દરમિયાન ડૉ. ડી.બી.સિસોદીયા, પ્રાધ્યાપક અને વડા, કીટકશાસ્ત્ર વિભાગ દ્વારા કીટકશાસ્ત્ર વિભાગની યોજનાકીય પ્રવૃત્તિઓ વિષે માહિતી આપવામાં આવેલ. ડૉ. એચ. સી. પટેલ, મદદ. પ્રાધ્યાપક, કીટકશાસ્ત્ર વિભાગ એ તાલીમનાં મુખ્ય હેતુઓ અનેઉપયોગીતા વિષે જાણકારી આપેલ.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન આકૃયુના વૈજ્ઞાનિકો દ્વારા ધાન્ય, કઠોળ, શાકભાજી, તેલીબિયાં તથા ઘાસચારા પાકોમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન, જીવાત વ્યવસ્થાપનના ઘટકો અને મોજણીની પ્રાયોગિક માહિતી, સંગ્રહેલા અનાજની જીવાતોનું નિયંત્રણ ઉંદરની વિવિધ જાતો, નુક્સાન અને નિયંત્રણ વગેરે જેવા વિષયો પર વિસ્તૃત જાણકારી આપવામાં આવેલ.

કાર્યક્રમના અંતિમ દિવસે ખેડૂતોને આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ ખાતે મધમાખી ઉછેર કેન્દ્ર, સરદાર પટેલ એગ્રિકલ્ચરલ એજ્યુકેશન મ્યુઝીયમ્મને શાકભાજી સંશોધન કેન્દ્રની મુલાકાત કરાવવામાં આવેલ હતી. કીટકશાસ્ત્ર વિભાગના તુલસી બીલ્ડીંગ ખાતે યોજાયેલ સમાપન સમારંભમાં તાલીમમાં ભાગ લીધેલ ખેડૂતોએ તેઓના પ્રતિભાવમાં જણાવેલ કે, ખેડૂત સમૂદાયમાં આ તાલીમ ખૂબજ ઉપયોગી સાબિત થશે.

તાલીમ કાર્યક્રમની ઝાંખીઓ

